

**RISHI TECHTEX LIMITED**

CIN: L28129MH1984PLC032008  
 Registered office: 612, VeenaKilledar Ind. Est., 10-14, Pais Street, Byculla (West), Mumbai-400 011.  
 Tel No. 022-23075677/23074585 Fax No. 022-23080022  
 WEB: www.rishitechtext.com Email: info@rishitechtext.com

**GENERAL INFORMATION TO SHAREHOLDERS**

As per the SEBI circular dated 3rd December, 2018 (PR No. 51/2018), the last date for holding the securities in physical form has been extended from 4th December 2018 to 31st March, 2019. The shareholders are requested to get their shares demated before 31st March 2019, failing which their shares will not be permitted to be transferred in physical form on or after 1st April, 2019. Therefore, Shareholders are requested to take immediate action on the said matter. For any clarification in this regards, please feel free to contact our RTA agent Adroit Corporate Services Pvt. Ltd or you can also contact to the Company for the same.

For Rishi Techtex Limited  
 Sd/-  
 Gauri Gangal  
 Company Secretary

Date :- 25/01/2019

Rameshwar Media

**NILA SPACES LIMITED**

(CIN No: U45100GJ2000PLC083204)  
 Registered Office: 1<sup>st</sup> Floor, Sambhaav House, Opp. Chief Justice's Bungalow, Bodakdev, Ahmedabad - 380 015.  
 Phone: +91 79 4003 6817/18 Fax: +91 79 26873922  
 E-mail: secretarial@nilaspaces.com Website: www.nilaspaces.com

**NOTICE**

Notice, pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, is hereby given that a Meeting of Board of Directors of the Company will be held on Tuesday, February 12, 2019 at the Registered Office of the Company to consider and approve the unaudited financial results for the quarter/ nine months ended on December 31, 2018.

You may also refer the website of the Company at [www.nilaspaces.com](http://www.nilaspaces.com) and stock exchange(s) at [www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com) for further details.

Date: January 26, 2019 For, Nila Spaces Limited  
 Place: Ahmedabad Company Secretary

Ind. Est. Pandesara Branch, Near Station, Pandesara, Surat - 394 221 Tel.: 0091 261 2890653, 2895447 Email: indpan@bankofbaroda.com



**DEMAND NOTICE TO GUARANTOR**

(UNDER SUB-SECTION (2) OF SECTION 13 OF THE SARFAESI ACT, 2002)  
 1. Mr. Rajendra Sohanlal Jain, B-2, Tara Jayant Apartment, B/h Lakshmi Vilas Apartment, Ghod Dod Road, Surat - Pin -395007, Gujarat.  
 Sub.: Notice under section 13(2) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, hereinafter called "The Act" A/c M/s JILL MILL JARI HOUSE

Dear Sir/s,  
 Re: Your guarantee for credit facilities granted to M/s Jill Mill Jari House  
 1. As you are aware, you have by a guarantee dated 29-06-2010, 28-03-2012, 24-12-2013 guaranteed payment on demand of all moneys and discharge all obligations and liabilities then or at any time thereafter owing or incurred to us by M/s. JILL MILL JARI HOUSE, for aggregate credit limits of Rs.1,65,55,280.24 with interest thereon more particularly set out in the said guarantee document. To secure the guarantee obligation you have also provided following securities to us:  
 2. To secure the guarantee obligation, you have also provided following securities to us: NIL  
 2. We have to inform you that the borrower has committed defaults in payment of his liabilities and consequently his account has been classified as non-performing asset. A copy of the notice dated 04/01/2019 under section 13 (2) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 sent by us to the Borrower is enclosed. Since the Borrower has committed defaults, in terms of the guarantee you have become liable to pay to the Bank, the outstanding amount of loan/credit facilities aggregating Rs. 1,65,55,280.24/- (Rupees One Crores Sixty Five lacs Fifty Five Thousand Two Hundred Eighty and Twenty Four Paise only) and we hereby invoke the guarantee and call upon you to pay the said amount within 60 days from the date of this notice. Please note that interest will continue to accrue at the rates specified in paragraph no. 1 hereinabove and paragraph 2 of the notice dated 04/01/2019 served on the Borrower (copy enclosed).  
 3. We further wish to inform you that in regard to the security provided by you to secure your guarantee obligations for the due repayment of the loans and advances by the



**GUJARAT INDUSTRIES POWER COMI**

Regd. Office: P.O.: Petrochemicals - 391 346, Dist.:  
 Tel. No.: 0265 - 2232768, Fax No.: 0265 /  
 Email: investors@gipcl.com Website: www.gipcl.com CIN

**NOTICE**

Notice is hereby given that the following Equity Share Certificate(s) of the Company and the holder(s) thereof have applied to the Company for issue of duplicate shares

FOLIO NO.	SHAREHOLDER'S NAME	CERTI. NO.(S)	DISTINCTIVE NOS.
00055734	INDERMAL LUNKER	55670	31492436 to 3149253
00071107	DINESH KR JAIN	71047	33030136 to 3303023
00174904	BJOLY PRODHAN	6190, 52221 56716, 57569 57663, 61386 84336	26544436 to 2654453 31597036 to 3159713 31691736 to 3169183 34359036 to 3435913
00157204	AMAR KUMAR BHAKTA	33801, 103632 119342	29305536 to 2930563 37859636 to 3785973
00116337	BHIKSHAM VANGAPALLY	116295	37554936 to 3755503
00192290	ANIL SHAH	44789	30404336 to 3040443
00160438	BINAY KUMAR SAU	1653	26090736 to 2609083
00173068	YOGESH R. SHAH	72712	33196636 to 3319673
00129447	SEEMA AHUJA	58431 73085	31768536 to 3176863 33233936 to 3323403
			<b>TOTAL</b>

The Public is hereby warned against purchasing or dealing with these securities claim in respect of the said Certificate(s) mentioned above, should immediate evidence of the claim to the Company so as to reach the Company within fifteen days of this Notice, failing which, the Company will proceed to issue Duplicate Certificate

Date : 24-01-2019  
 Place : Vadodara.

**NOTICE**



**NOTICE TO THE UNIT HOLDERS OF SBI EQUITY**

SBI Mutual Fund Trustee Company Private Limited, Trustee, have approved dividend under Dividend option of SBI EQUITY

Scheme Name	Plan	Quantum of Dividend Per Unit (₹)	Record Date
SBI Equity Hybrid Fund	Regular Plan	0.24	January 31, 2019
	Direct Plan	0.35	

Pursuant to payment of dividend, the NAV of scheme / plans would fall to the extent of statutory levy, if applicable. Dividend Distribution of distributable surplus and statutory levy (if any). All Owners of the above scheme, whose name(s) appear in the Statement of Beneficial Owners of SBI Mutual Fund / the statement of beneficial owners of Depositories on aforesaid record date, will be entitled to receive the dividend.

For SBI Funds Management Private Limited

Place: Mumbai  
 Date: January 25, 2019

Asset Management Company  
 SBI Funds Management Private Limited

